



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૯/૦૯/૨૦૧૮ બુધવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૮૨૪/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૬૧ કેસ કરી, ૬૧ વ્યક્તિઓને ઝડપી, ૩૮ લીટર દેશી દારૂ, ૧૬૨ બોટલ ઈંગ્લીશ દારૂ અને ૧ ઈંકો ગાડી કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૩ કેસ કરી ૧૦ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૫૯,૩૨૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૮૨૫/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૬૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી તેમજ પ્રોહી ૯૩ મુજબ ૮ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૧૮૨૬/૧૮

સરદારનગર: મહેશભાઈ જયંતીભાઈ પટેલ (ઉ.વ.૪૦)(રહે.પારસ બંગ્લોઝ ૧૦૮ સામે કઠવાડા રોડ નરોડા) એ સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૬/૦૯/૧૮ સાંજના ૬/૦૦ થી તા.૧૭/૦૯/૧૮ સવારના ૬/૩૦ વાગ્યા દરમિયાન નોબલનગર નંદીગ્રામ નાલંદા વિધ્યાલયની ઓફીસના દરવાજાનું તાળુ તોડી અજાણી વ્યક્તિ ઓફીસમાં પ્રવેશ કરી ટેબલના ડ્રોઅર તથા તીજોરીમાંથી એક મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૫૦૦/- અને રોકડ રૂપિયા ૪૭,૦૦૦/- મળી કુલ રૂપિયા ૪૭,૫૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.એમ.ઠાકોર ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૧૮૨૭/૧૮

ઇસનપુર: અલ્પેશભાઈ ગીરીશભાઈ ઠક્કર(રહે,ગોકુલનગર સોસાયટી, જયમાલા બસ સ્ટેન્ડ પાસે મંગલેશ્વર મહાદેવ રોડ ઇસનપુર) એ ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૮/૦૯/૧૮ કલાક ૨/૦૦ થી ૬/૦૦ વાગ્યા દરમિયાન પોતાના મકાનના રૂમની ખુલ્લી જાળી વાટે, અજાણી વ્યક્તિ મકાનમાં પ્રવેશ કરી, તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા ૫,૫૦૦/- તેમજ અગત્યના દસ્તાવેજો મળી કુલ રૂપિયા ૧,૨૨,૫૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી કે.જી.જલવાણી ચલાવે છે.

દાણીલીમડા: ઉસ્માનગની મેઘરજીયા ધાંચી (રહે, ગુલજારપાર્ક ગેટ નંબર-૧ જુહાપુરા સરખેજ રોડ) એ તા.૧૮/૯/૧૮ નારોજ દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૯/૦૮/૧૮ બપોર ૩/૦૦ વાગ્યાના સુમારે શાહઆલમ રોડ ત્રણ બત્તી પાસે અનાજના ગોડાઉન નજીકથી પાણીની પાઇપ નંગ-૧૧ કિંમત રૂપિયા ૧,૯૮,૦૦૦/- મતાની અજાણી વ્યક્તિ ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જે.આર.પટેલ ચલાવે છે.

ચીલ ઝડપ:-

સમાચાર યાદી નં.૧૮૨૮/૧૮

પાલડી: પાણલબહેન હીતેશકુમાર શાહ (ઉ.વ.૫૭)(રહે, પાર્શ્વનાથ નગ્ર સોસાયટી, નવા શારદા મંદીર રોડ પાલડી) તા.૦૬/૦૯/૧૮ બપોરના ૪/૧૫ વાગ્યાના સુમારે રીક્ષામાં બેસી પસાર થઈ રહ્યા હતા દરમ્યાન રાજકૃપા ફ્લેટ સામે એક્ટીવા ઉપર આવેલ એક પુરૂષ રીક્ષા નજીક આવી, પાણલબહેનના ખોળામાંથી પર્સ ઝુટવી લઈ નાસી ગયો હતો. જે પર્સમાં એપલ કંપનીનો આઇફોન ૭ પ્લસ કિંમત રૂપિયા ૪૦,૦૦૦- તેમજ એક્સીસ બેંક નું ક્રેડીટકાર્ડ, ડ્રાઇવિંગ લાયસંસ, ઘરની ચાવીઓ અને રોકડ રૂપિયા ૫,૦૦૦/- મળી કુલ રૂપિયા ૪૫,૦૦૦/- મતા હતી. આ અંગેની ફરીયાદ પાણલબહેન શાહે તા.૧૮/૯/૧૮ નારોજ પાલડી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ હે.કો.શ્રી દીલીપ નાગરાજભાઈ ચલાવે છે.

મંગળસુત્ર ખેચી તોડી લઈ ગયા:-

સમાચાર યાદી નં.૧૮૨૯/૧૮

શાહીબાગા: ડૉ.રાજા રાજેશ્વરીદેવી વા/ઓ નવીનરાજાશેખર (ઉ.વ.૨૮)(રહે, પી.જી.હોસ્ટેલ ફેઝ-૧, સિવિલ હોસ્પિટલ કેમ્પસ શાહીબાગ) તા.૧૮/૦૯/૧૮ રાતના ૧૦/૧૫ વાગ્યાના સુમારે શાહીબાગ રચના સ્કુલ નજીકથી એક્ટીવા ચલાવી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ રાજા રાજેશ્વરીદેવીના ગળામાંથી મંગળસુત્ર કિંમત રૂપિયા ૮૦,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયા હતા. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી એ.કે.પટેલ ચલાવે છે.

વાહન ચોરી:-

સમાચાર યાદી નં.૧૮૩૦/૧૮

સરખેજ: વિનોદભાઈ દલપતભાઈ વેગડા (રહે, શક્તિનગર સોસાયટી નવી ફતેવાડી તલાવડી પાસે ઘોળકા સરખેજ રોડ) એ તા.૦૬/૦૯/૧૮ રાતના ૮/૪૫ વાગે ફતેવાડી ખાતે આવેલ ભારત કોપ્લેક્ષ સામે પોતાની ટોયોટા ગાડી નંબર જીજે.૦૧.આર.બી.૮૬૬૬ કિંમત રૂપિયા ૭,૦૦,૦૦૦/- પાર્ક કરી હતી. જેની ચોરી તા.૦૭/૦૯/૧૮ કલાક ૯/૩૦ વાગ્યા દરમ્યાન થઈ હતી. આ અંગેની ફરીયાદ વિનોદભાઈ વેગડાએ તા.૧૮/૯/૧૮ નારોજ સરખેજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી વી.સી.મકવાણા ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૧૮૩૧/૧૮

વેજલપુર: સમાબેન વા/ઓફ મોહંમદયુનુસ શેખ (રહે. સ્ટાર ડુપ્લેક્ષ વિભાગ-૩ રહેમાની મસ્જીદ સામે સહેજાદ પાર્ક નસીમપાર્લરની લાઈનમા ફતેહવાડી) એ બિમારીથી કંટાળી તા.૧૮/૯/૧૮ કલાક ૯/૩૦ થી ૧૦/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના ઘરે પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે વેજલપુર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પ્રો.પો.સ.ઇ.શ્રી ડી.બી લાખણોત્રા ચલાવે છે.

ચાંદખેડા: કિરણભાઈ હરજીભાઈ ચૌહાણ (ઉ.વ.૧૯) (રહે. ગણેશનગર નર્સરી વિસત પેટ્રોલપંચ પાછળ ચાંદખેડા) એ અગમ્ય કારણસર તા.૧૭/૯/૧૮ રાતના ૧૧/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે રસોડામાં લોખંડની પાઈપ સાથે નાયલોનની દોરી બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે ચાંદખેડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી સુરેશભાઈ મંગળભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.